

# ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી

:: સુધારા યાદી ::

વંચાણે લીધી:(1) આયોગની તા.02.08.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.

(2) આયોગની તા.28.12.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની બીજી યાદી.

(3) આયોગની તા.17.01.2018ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી

1 આયોગ દ્વારા પ્રસિધ્ધ થયેલ સરકારી વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ખાતે રસાયણશાસ્ત્ર વિષયના મદદનીશ પ્રાધ્યાપક, ગુજરાત શિક્ષણ સેવા, વર્ગ-2 (કોલેજ શાખા) (જા.ક. 84/2016-17) સંદર્ભમાં આયોગ દ્વારા તા.02.04.2017ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે તા.02.08.2017 ના રોજ અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 103 ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી હેઠળની નોંધ: 5 (25) થી “અરજી ચકાસણીને પાત્ર ઠરેલ આ ઉમેદવારોને, આ જાહેરાતના અનુસંધાને તેમણે કરેલ ઓન-લાઇન અરજીની પ્રિન્ટેડ નકલ, જરૂરી દસ્તાવેજો સાથે આયોગની કચેરીમાં સંયુક્ત સચિવશ્રી (આર-7)ને મોડામાં મોડુ તા.16.08.2017 સુધીમાં મળે તે રીતે મોકલી આપવા જણાવવામાં આવેલ હતું.”

2. આ 103 ઉમેદવારોના બેઠક નંબરોની પાત્રતા ચકાસણી બાદ નોર્મ્સ મુજબ રૂબરૂ મુલાકાત માટે પાત્ર પુરતા ઉમેદવારો ન મળતા લાયકી ધોરણ નીચું લઈ જઈ વધુ કુલ: 08 બેઠક નંબરોની બીજી યાદી તા.28.12.2017 ના રોજ અરજી ચકાસણી માટે જાહેર કરવામાં આવેલ હતી. ત્યારબાદ અરજી ચકાસણીને અંતે તા.17.01.2018 ના રોજ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા 101 ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી.

3. અરજી ચકાસણીને પાત્ર ઠરેલ ઉમેદવારોની અરજી ચકાસણી (Scrutiny) કરતાં બેઠક નંબર 101000638 પરના આ ઉમેદવારે આ જાહેરાતના અનુસંધાને તેમણે કરેલ ઓન-લાઇન અરજી ની પ્રિન્ટેડ નકલ, જરૂરી દસ્તાવેજો સાથે આયોગની કચેરીમાં જમા કરાવેલ નથી. પરંતુ આયોગની કચેરી દ્વારા તા.17.01.2018ના રોજની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં બેઠક નંબર 101000638 પરના ઉમેદવારને શરતચૂકથી રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવેલ હતા.

4. પાત્રતા ચકાસણી મુજબ અનુ.જાતિ (કોમન) વર્ગના બેઠક નં.101000638 પરના ઉમેદવારે અરજી પત્રક રજૂ કરેલ ન હોવાથી તેઓની ઉમેદવારી રદ કરવામાં આવેલ હોય, રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવાના થાય છે. પ્રસ્તુત જાહેરાત સંબંધે હવે અનુ.જાતિ (કોમન) વર્ગના ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા આયોગના તા.14.10.1986 ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ અનુસાર નક્કી કરતાં આ જાહેરાતમાં જણાવેલ અનુ.જાતિ (કોમન) વર્ગના ઉમેદવારોની કુલ: 04 અનામત જગ્યાઓ માટે નોર્મ્સ મુજબ કુલ: 12 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવાના રહે છે.

# 2 #

5. અનુ.જાતિ (કોમન) વર્ગની મેરીટ યાદી ધ્યાને લેતાં બેઠક નંબર 101000638 પરના ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણતાં હવે બેઠક નંબર 101000446 પરના ઉમેદવાર આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા હોવાથી રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદીમાં અને અનુ.જાતિ (કોમન) વર્ગના બેઠક નં. 101000638 પરના ઉમેદવારનો રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની યાદી હેઠળની નોંધ (1): “આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોઈ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માં સમાવેશ કરવામાં આવે છે.

6. આથી હવે રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી હેઠળની નોંધ: (1) ના ઉમેદવારોની કુલ સંખ્યા 08 થશે અને બેઠક નં. 101000446 પરના ઉમેદવારનો યાદી હેઠળની નોંધ (2) “જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરે છે, પરંતુ આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવતા ન હોઈ રૂબરૂ મુલાકાતને પાત્ર થતા નથી.” માંથી રદ કરતાં ઉમેદવારોની કુલ સંખ્યા 02 થશે. આયોગની કચેરી દ્વારા તા.17.01.2018ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010

તારીખ: 30.01.2018

Sd/-

સંયુક્ત સચિવ

ગુજરાત જાહેર સેવા આયોગ